



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૫/૧૧/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૨૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૪ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૧૫૧ લીટર દેશી દારૂ, ૧૮ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧ સ્કુટર અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૪ કેસ કરી ૧૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૨,૫૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૩૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૨૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૨૩૧/૧૮

વાડજ: રાજેશભાઈ નવનીતભાઈ પવાર (રહે.શ્રી કો.ઓ સોસાયટી નારોલ) એ તા.૧૪/૧૧/૧૮ નારોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૧૦/૨૦૧૧ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) કંચન દત્તા ડાયરેક્ટર (૨) રવિંદ્રસિંગ સિંધુસિંગ ડાયરેક્ટર (૩) કે એસ. બાલ ડાયરેક્ટર (૪) દશરોજી મેનેજર અને (૫) મલયભાઈ એરીયા મેનેજર એ ભેગા મળી નિલકંઠ એવન્યુ પહેલો માળ સી.યુ શાહ કોલેજની ગલી ઇન્કમટેક્સ કીમ ઇન્ફાસ્ટ્રક્ટર & ડેવલોપમેન્ટ લી તથા સેક્ટર કોમ્પ્રિયલ એસ્ટેટ લી.તથા હેલ્પ ફાઇનાન્સ નામની કંપની ઇન્કમટેક્સ ખાતે રાજેશભાઈ પવાર તથા સાહેબના કંપનીમાં ફિક્સ ડીપોઝીટ કરાવી પાકતી મુદતે મળવાપાત્ર નાણા ૩,૦૦,૦૦૦/- તથા પાંચ મહીનાનુ વ્યાજ રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૫૦,૦૦૦/- નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એન.સુથાર ચલાવે છે.

વેજલપુર: ભરત ઓમપ્રકાશ ચૌહાણ (રહે.અખીલેશ સોસાયટી વેજલપુર રોડ) એ તા.૧૪/૧૧/૧૮ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે માર્ચ/એપ્રિલ ૨૦૧૭ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી નિર્મલ બજાજ (રહે.૭૦૮, સેફ્ટોન કોમ્પલેક્સ ફતેહગંજ વડોદરા) તથા ગાયત્રી મહેતા નાઓએ હિન્દી દૈનિક પેપરમા “ટેમ્પરરી રેસીડેન્ટ પરમીટ (ટી.આર.પી) ઈન યુરોપ” ની લોભામણી જાહેરાત આપી તેઓની “વીજા સોલ્યુશન ફોર યુ” ના નામથી આપી ભરત ચૌહાણને તથા તેના મિત્ર શૈલેષ પવાર નાઓને યુરોપમા ટી.આર.પી. (ટેમ્પરરી રેસીડેન્ટ પરમીટ) અપાવવાના બહાને ભરત ચૌહાણ પાસેથી રૂપિયા ૪,૧૭,૦૦૦/- તથા શૈલેષ પુવારના આશરે રૂપિયા ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૯,૧૭,૦૦૦/- મેળવી લઈ આજદીન સુધી ટી.આર.પી. નહી અપાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.ડી.રોહીત ચલાવે છે.

નીકોલ: બાબુભાઈ નાનજીભાઈ જેઠવા (રહે.મીરા પાર્ક નારાયણનગર ખોડીયારનગર) એ તા.૧૪/૧૧/૧૮ નારોજ નીકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૮/૧૮ થી તા.૦૭/૦૯/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) રાકેશભાઈ મગનભાઈ પાનસુરી (રહે. શ્રીનાથ પાર્ક વિભાગ-બી ઉત્તમનગર નિકોલ ગામ રોડ) (૨) શીવાભાઈ કરશનભાઈ ગોહીલ (રહે. નીધી એપાર્ટમેન્ટ રતનબા સ્કુલ રોડ બદરીનારાયણ સોસાયટી પાસે ઠક્કરનગર) (૩) દિપાભાઈ પેંઈનટર (રહે. હિરાવાડી) એ ભેગા મળી અલોક સોસાયટી મહાદેવનગરની બાજુમા વેરાનાક કાઠે નિકોલ ખાતે બાબુભાઈ જેઠવા સાથે ઉપરોક્ત વેપારીઓનુ એમ્બ્રોડરીનુ કુલ રૂપિયા ૩૬,૬૧,૦૦૦/- મજૂરીકામ કામ નાણા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.જે.ખાંટ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૨૩૨/૧૮

નારોલ: નથુભા જીવુભા દરબાર (રહે.ચેપી રોગ હોસ્પિટલ સામે પીરાણા રોડ બહેરામપુરા) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૧૧/૧૮ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે નારોલ સરખેજ હાઇવે શ્રી નાથ હોટલ સામેથી નથુભા જીવુભાનો ભત્રીજો પસાર થઈ રહ્યો હતો ત્યારે હોન્ડા સીટી કાર નંબર જીજે ૧ કેડી ૭૧૪૨ ના ચાલકે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા નથુભા જીવુભાના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા તેનુ મૃત્યુ નિપજ્યું હતુ. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જે.બી.રાહોડ ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૨૩૩/૧૮

અમરાઇવાડી: સુનીતાબહેન વા/ઓ વિજયભાઈ ગુપ્તા (ઉ.વ.૨૮) (રહે.જોગમાયાનગર અમરાઇવાડી) તા.૭/૧૧/૧૮ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે બાળકો સાથે ફટાકડા ફોડતા હતા ત્યારે ફટાકડાના તણખાથી પહેરેલ કપડાને આગ લાગતા દાઝી ગયા હતા. સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૪/૧૧/૧૮ કલાક ૭/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી સી.પી.રાવ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૨૩૪/૧૮

ઇસનપુર: અર્પિતા ડો/ઓ કાંતિભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) (રહે.જોગેશ્વરી સોસાયટી વિભાગ-૨ કંકુબા સ્કુલ પાસે ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૧૪/૧૧/૧૮ સાજના ૫/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી વા.જી.માથુકીયા ચલાવે છે.

નિકોલ: વિજયભાઈ પ્રેમજીભાઈ ડાભી (ઉ.વ.૨૮) (રહે. શિવ દર્શન સોસાયટી મનમોહન ચાર રસ્તા નિકોલ) એ અગમ્ય કારણસર તા.૧૪/૧૧/૧૮ સવારના ૯/૨૫ વાગ્યા પહેલા પોતાના રહેણાંકમાં લોખંડના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી રાજેન્દ્રસિંહ જસવંતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.